

UDHNA CITIZEN COMMERCE COLLEGE &
SPB COLLEGE OF BUSINESS ADMINISTRATION & SHRIMATI
DIWALIBEN HARJIBHAI GONDALIA COLLEGE OF BCA & I.T.

S.Y.B.Com. Semester-3 2026-27

Subject:Banking

Unit -1 Banker and customer Relationship:

Definition of banker & customer- general & legal relation of banker and customers- Bankers as borrower – A debt by a banker vs. an ordinary commercial debt -Rights of banker -bankers Lien and right of set off-banker's right to charge interest and commission. – Banker's obligation to maintain secrecy of the customer's accounts.

Unit -2 Payments and Collection of Customer's cheque

Meaning of payments of cheque – Meaning of collection of cheque - Precaution – Payments in due course – When a banker is justified in Refusing payment-wrongful dishonor cheque-countermanding payments of cheque and drafts – protection given to a paying banker. The banker as holder for value-collecting banker and his customer- – precaution-duties of a collecting banker- Protection given to a collecting banker.

એકમ 1 બેન્કર-ગ્રાહક સંબંધ

બેન્કર-ગ્રાહકની વ્યાખ્યા, સામાન્ય સંબંધો – બેન્કર અને ગ્રાહકના કાનૂની સંબંધો -નાણાં ઉછીનાં લેનાર તરીકે બેન્કર-બેન્કરનું દેવું વિરુદ્ધ સામાન્ય વેપારીનું દેવું-બેન્કરનો હક-બેન્કરનો ધારણાધિકાર (લિયન) અને સેટ ઓફ અંગેનો બેન્કરનો હક-વ્યાજ અને કમિશન ચાર્જ કરવાનો બેન્કરનો અધિકાર -બેન્કરની ગ્રાહકના ખાતાની ગુપ્તતા જાળવવાની ફરજ.

એકમ -2 ગ્રાહકોના ચેકની ચુકવણી અને વસૂલાત.

ચેકની ચુકવણીનો અર્થ –ચેકની વસૂલાતનો અર્થ- સાવચેતીઓ-યથાનુક્રમે ચુકવણી –બેન્કર ક્યારે ચેકનાં નાણાં ચૂકવવાનો ઈન્કાર કરી શકે-ચેક ખોટી રીતે નકારવો-ચેક અને ડ્રાફ્ટની ચુકવણીની અટકાયત -નાણાં ચૂકવનાર બેન્કરને રક્ષણ-મૂલ્ય સામે ધારણ કરનાર બેન્કર-ચેકની વસૂલાત કરનાર બેન્કર અને ગ્રાહક – સાવચેતીઓ – નાણાં વસૂલ કરનાર બેન્કરની ફરજો-વસૂલ કરનાર બેન્કરને રક્ષણ.

